

ଶ୍ରୀକୃତ୍ସମ୍ପଦ



ବିଜୟ
ପାତ୍ର

ગુજરાત વિદ્યાર્થીનું પ્રથમાન
| ગુજરાતી કાર્યપીઠાના વિભાગ |

અનુક્રમાંક ૨૨૨૨૩ કિસ્ત ૦.૪૮.

તૃણાંશુ ૫૧૨૦૮ માઝાંદાચ

બાબાંક ૩ - ૩

વધ્ય ૪ શું નવચૈતન પ્રકારાન : ૨૭
આપણું બાળભયમાળા પુરુતક ૧ લું.

કલમની પીંછી થી

-: લેખક :-
સ્વ. શ્રી. ગિજુભાઈ

-: ચિત્રલેખા :-
શ્રી. સુશીલા ઘેરો

-: સંપાદક :-
સોમાભાઈ ભાવસાર : હિનેશ ઠાકોર

નવચૈતન સાહિત્ય મંદિર
૨૪૫૬; લદ્રાં અમદાવાદ.

— : પ્રકાશક :
પુરુષેતામ પૂ. પારેખ
નટવરલાલ લ. વોરા
નવચ્યેતન સાહિત્ય મંદિર. ૨૪૫૬; લદ્દ, અમદાવાદ.

બિધાપીઠ
નાનાદાદ
દુર્ગાદી કોણીરાઈ ૨૩૮
૨૨૪૮૬

સર્વ ૬૫ સ્વાધીન

કિંમત

• — ૪ — •

— : મુદ્રક : —

મણિલાલ છગાનલાલ શાહ
નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ
ધીકાંટા : અમદાવાદ.

ન વે દ ન

આપણું બાળથી માળાના ૪ થા વર્ષની ૧ લી ચોપડી
તરીકે સુ. શ્રી. ગિજુલાઈની ‘કલમની પીંઠી’ નામની
ચોપડી ધરતાં અમને આનંદ થાય છે.

જીવતાં પાત્રોને જોઈને-અવક્ષેપીને સુ. શ્રી. ગિજુલાઈની
કલમે જીવંતપાત્રો શાહીકારા ને રીતે આ ચોપડીમાં
રજુઆત છે તે ખરેખર અદ્ભુત છે. આ ચોપડીનાં ચિત્રો
તેમની પુત્રી શ્રી સુશીલાને હોયાં છે.

ગુજરાતનાં ખાલિકોને સુ. ગિજુલાઈની આ ચોપડી
ગમી જશે એવી અમને આશા છે. આ લખીએ છીએ ત્યારે
એમની ખોટ અમને સાલ્યા વિના રહેતી નથી. પ્રભુ એમના
આત્માને શાંતિ આપો.

સંપાદકો

■ અ નુ ક મ ણિ કા ■

ક્રમ	લેખ	પાઠ
૧	શવો શક્રવારીએ....	૫
૨	ગોવો ઝીટર	૯
૩	વિઠલો વેદાણો	૧૪
૪	માણ	૨૧
૫	કાનો રખારી	૨૭
૬	નથુ પીળરો	૩૦
૭	રત્નો ભાડ	૩૬

✽ ✽ ✽ ✽ ✽ ✽ ✽ ✽ ✽ ✽

■ ■ ■ ■ ■ શવો શક્રવારીએ



શવાને બધા શક્રવારીએ કહેતાં. શુક્રવાર આવે ને શવો દાળીએની રેંકડી લઈને ગામમાં નીકળે.

શવો રેંકડી ધકેલતો જય ને સાઠ પાડતો જયઃ ‘ગરમા ગરમ શક્રવારીએ, બેર ગરમાં ગરમ ચણુા, ગરમા ગરમ શક્રવારીએ...’

શવાનો સાઠ નાનાં છોકરાં સાંભળે, છોકરાની બા સાંભળે, છોકરાનાં દાદા સાંભળે, દાહી સાંભળે.

દાદા કહેશે, “એલા આજે તો શક્રવાર લાગે

છે. દાદી કહેશે, “ હા, શક્રવારી દાળીએ. ” દાદા દાહીના મોઢામાં દાંત નહિ પણ ખાવાનું મન થાય.

બા એન કહેશે, “ હ્યો, ઘડીકવારમાં તો શક્રવાર આવ્યો. જણે ગઈકાલે જ મશાલા દાળીએ કર્યા’તા ને ખાધા’તા. નાનાં બાળકો કહેશે, “ એ બા, શવો નીકળ્યો છે, શક્રવારીએ નીકળ્યો છે, અમારે દાળીએ લેવા છે. ”

બા અને એનને દાળીએ ખડુ ભાવે. દાદા દાહીનેયે ભાવે તો ખરાજ ને ! પણ એનાથી કંઈ રેંકડીએ જવાય છે ?

બા એન કહેશે, “ હીક લ્યારે, એ પૈસાના લઈ આવો. ”

એન કહેશે, “ એટલે દાળીએ નહિ થાય. ”

દાદા કહેશે, “ ચાર પૈસાના લાવે ને ભઈ, છાકરાં દાળીએ ખાઈ રાજ થશે. ”

ચાર પૈસાના દાળીએ લાવે. શવો તાજુડી લ્યે, દાળીએ તોળે, ઉપર ચોડુંક મીઠું મરચું ભભરાવે ને પડીકું વાળીએ આપે.

છોકરાં દાળીએ લઈ બા પાસે હોડે.

બા કહેશે, “અહીં આવો, આપણે ભાગ પાડીએ”

બા ભાગ પાડે. “આટલા દાળીએ દાદા દાહીના.

એને કાંઈ દાંત છે ? ખાંડીને ભૂકો કરીને ધી ગોળ
નાખીને ખવરાવશું. આટલા દાળીએ તમારા. ઈયો
તમારા ખીસામાં. આતા જાઓ ને રમતા જાઓ ને
આટલા હવે અમારા. આટલામાં તો એન એને હું
ખાશું ને વર્ણી તમારા બાપા માટે પણું રાખીશું”

છોકરાં દાળીએ લઈ ઉપડી જય. બા એન અ-
થાણુાની બરાળુંનીએ ઉધાડે. રાતું ચોળ તેલ ને
મરચું કાઢે ને દાળીએમાં ભેળવે. પછી સૂદૂ સૂદૂ કરતાં
આતા જય ને દાળીએને વખાણુતા જય.


દાદાજીને તો દાળીએ ખાંડી હેવા પડે. પણ
દાદાજી પોતે જ હૈંશિલા. એટલે ખારાળી લે, દરતો
લે. એને હળું હળું પોતે જ દાળીએ ખાંડે. પછી દાદાજી
પોતે એમાં ગોળ ભેળવે એને જરાક ધી નાંખી દાદા
દાદી દાળીએનો લાઉવો ખાય.

સાંજે બાપા આવે. ચંપકની બાકહેશે, “ઈયો,

આ હાળીઓનો તમારો ભાગ રાખ્યો છે તે. આ હાળીઓના લાડવાનો કટકો. હાદાળને લાડવો કરી દીધો હતો. એને લાડવો બહુ ભાવે.”

બાપા કહેશે, “હા, એલા, આજતો શક્રવાર છે ને? શવો શક્રવારીઓ આવ્યો લાગે છે. માણો એ જખરો છે, રેંકડી લઈને નીકળતું, છોકરાંને ઝોસલાવવા ને હાળીઓ વેચી પૈસાહાર થવું.”

સૌ શવા શક્રવારીઓનો વાંક કાઢતા જય, હાળીઓની વાત કરતા જય ને વર્ણી પાછા આવતા શક્રવારની વાટ જેતા જય.



ગોવો શ્રીટર



કૃષ્ણ એટલે એન્જનમાં
કામ કરેનારો. ગોવો પહેલાંનો
એવો એક શ્રીટર હતો પણ
હમણાં એ ધરડો થઈ ગયો
છે. હવે એ હથ્યાડા ઉપાડી
નથી શકતો. હવે એ એન્જ-
નમાં કોલસા નાખી નથી શકતો. હવે એ એટલી
ખદી મહેનત કેમ કરી શકે? હાથ પગ ઢીલા થઈ
ગયા છે. આંખેય પૂં કળાતું નથી.

શ્રીટરનો પગાર તો કેટલોક હોય તે બસો પાંચ-
સોની મૂડી કરે? રહ્યું એટલું ખાંધું અને ખાંધું
એટલું રહ્યો. પણ ધરડો થયો એટલે મીલમાંથી

રજ લઈને ઘેર એઠો. હવે એણું કરવું શું? જિંહંગાં
આખી લોઢામાં અને આગમાં ગાળી પણ હિતો ઈના
કરત્યા. હવે એણું કરવું શું?

ગોવો બિચારો પંડુપંડ છે. એક બાયડી હતી
તે તો મરી ગઈ ને છોકસંછૈયું તો થયું જ ન હતું.
તાણે આ એકલા પંડુને ખવરાવવું તો પડે ના.? પેર
મારો એનું શું?

ગોવાએ હમણું એક હાટડી કરી છે. ધાસલેટ,
દીવાસળીના ખાકસ, રેવડી, શીંગ, દાળિયા, મમરા,
ગોળ, એનું એવું ગોવો રાખે છે અને સાંજ પડુંચે
બે પૈસા કમાય છે. આવી હાટડીમાં કમાળી તે શું
થાય ને વળી આવા વખતમાં!

ગોવો કમાય એટલું ખાય લારે માંડ પેરભરાય.
વકરામાંથી ગોવો ચોડોક લોટ લાવે, દુંગળીના ગાંધિયા
લાવે, પાઈઅડ્વી પાઈનું મીઠું મરચું લાવે ને ગોવો
રોટલાને દુંગળીનું શાક ખાય. કોઠવાર તો એકલા
રોટલાને મીઠુંએ ખાવું પડે. કોઠવાર ગોવો ભૂખ્યો
પણ પડ્યો રહે. વખતે લોટ નહોય તો વખતે પોતે જ

માંહો હોય. એનો કયો સર્ગો લોટ આપે અને કઈ કાકી એને રોટલો ધડી આપે? હાડ હાલતાં હતાં ત્યાં સુધી 'ગોવો ઝીટર ગોવો ઝીટર.' હાડ ખખજુયાં એને ધડપણ આવ્યું એટલે સૌ સૌને રરતે! ગોવો બિચારો ગોવલો. એનું કોણુ?

ગોવાને મેં ગાઈકાલે હાટડીમાં જેયો. હું કેટલાયે વર્ષે ગામમાં આવેલો તે એને માંડ માંડ એણખ્યો. પહેલાં તો એ હાટડીમાં ગાળો કુરો રહેતો હતો. મને વહેમ પણ નહિ કે ગોવા ઝીટરે હાટ માંડયું હશે.

અમે નાનાહતાલ્યારે બાપાની સાથે ઝુના જીનમાં જતા. બાપા અમને ખદું સાથે રહીને ખતાવતા. એન્ઝીનની કેઠી આગળ એક પારસી બેસતો. એને અમે ઈજનેર કાકા કહેતા. એનું નામ કેકુ હતું. અમે એને કેકુકાકો કહેતા. કેકુકાકા આરામ ખુરશીમાં બેસતા એને ઝીટરોને હુકમ કરતા. હુકમ પ્રમાણે ઝીટરો કામ કરતા. ઝીટરોમાં ગોવો પણ હતો.

ગોવો તે વખતે પૂરા વીસ વર્ષનો. જરા જરા મૂછ આવેલી. શરીરે ઊંચો અને ધીંગો, હાથના

ખાંવડા ઉપર તો ગોટલા બાજેલા. પગની પીંઢીએ
તો જણે લોઢાની. ગોવો ધડીક હાથમાં પાવડો લે
અને ડોલસા નાખે. ગોવો ધડીક હાથમાં હંશોડો લે
અને લોહું દીપે. ધડીકમાં એન્જિન ઉપર આંદો મારે
અને અહીંતહીં તેલ પૂરે. પસીનો લૂછતો જય અને
ધમ ધમ ચાલતો જય. કેદુકાકા તો હુકમ કરી જણે.
એની જલ હાલે અને ગોવાના હાથ પગ હાલે. સાંજ
પડે લ્યાં તો ગોવો કેટલુંચે કામ કરી નાખે.

ગોવાને મારા બાપા આળખતા. બાપા કહેશે: ‘કાં
ગોવા, કેમ ચાલે છે?’ હસીને ગોવો કહેતો: ‘એ બાપા
તમ પરતાએ લહેર છે !’ ગોવો વધારે વાત કરવાએ ન
રોકાય ને કામે જય.

મને થયું, આ હાટડીમાં ઘેઠો ગોવો ઝીટર
ખરો, પણ તે હિ'નો ગોવો ઝીટર અને આજનો ગોવો
ઝીટરમાં લાખ ગાડાનો ઝેર. મને થયું, કચાં એ ઝીટ-
રનું શરીર અને કચાં આ તેસાનું શરીર !

મેં પૂછ્યું: ‘કાં ગોવા ઝીટર કેમ છો ?’ આંખ
તાળીને ગોવાએ મારી સામે જોયું. ધારી ધારીને
બેઠીને કહે: ‘તમે કે ભાઈ, ભગવાનદાદાના હીકરા

ના ? મને થયું કે ગોવો ફીટર કહીને બોલાવનારો તો
કાળું હશે ? ભાઈ, એ ફીટરના દિ'તો ગયા. હવે તો
આ સૌ ગોવાદાદા, ગોવાડોસા કહીને બોલાવે છ.
જુઓને હવે તો ધરપણ આવ્યું ને આ....'

ગોવાની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. જુલ
આગળ ચાલી નહિ. મેં મારા આંસુ કળાવા નહીધા.



● ● ● ● ● विठ्ठले वेढाणो



આવुં તે નામ
શા મારું પડ્યું હશે ?
વેઢાળો એટલે વળી શું ?
એટલે એમ કે ગામ સમો
એકલો વિઠલો જ હેંશિ-
યાર કે ગમે તેણો વેઢા-
વાળા લાકડા વિઠલો
કાડી હે.

લાકડામાં બાવ-
ળા લાકડા કૃદવા
આકરા. અને એમાંથે એના વેઢા કૃદવા એ તોખા
ભગવાન ! એક એક વેઢો કૃદતાં છાતી ઊંચી થઈ
જય ને હાથને ગોટલા બાજે.

વિઠલો નાનપણુથીજ લાકડા ઝડપાનું કામ કરતો. એનો ખાપ પણ લાકડા ઝડપતો. એના ખાપનો બાધે ય લાકડા ઝડપતો. હાઠથી એ લોકો લાકડા ઝડપાનું કામ કરતા.

બિચારા ખવા લાકડા ઝડપી ઝડપીને મરી ગયા ને એની પાછળ હથોડા અને છીણુંચ્ચો મૂકૃતા ગયા. વિઠલાના બાધે એની વાંસે વિઠલો મૂકૃયો ને સાંચ બે હથોડા અને ચોડીક છીણુંચ્ચો મૂકી.

હસ વરસથી વિઠલો કામ કરવા મંદ્યો. વિઠલો લાકડાની વખારે જય અને નાના લાકડા ઝડપ. મુળજુ સુથાર રોજ આનો બે આના આધે અને હિ' ખંધો કામ કરાવે. ખાપે જિંદગી આખી લાકડા ઝડપયા અને હાડકાની કોચ્ચિંચ્ચો કરી નાખી ત્યારે વાંસે એક હિ'નું ખાવાનું ન નીકળ્યું. પછી નાની મોટી મુહી તો શું નીકળો ! સાંજ પહુંચે માંડ રોટલો કમાય એમાં વિઠલાને ભણ્ણાવે પણ શું ? વિઠલો નાનપણુમાં આથડયો અને હસ વરસનો દાડીએ ચડ્યો. દાડી ન કરે તો સાંજે માખાપનું શું ?

મા હતી પણ એ તો અપંગ જેવી હતી.

બિચારી કોઈનાં દળણાપાણી પણુ કરી શકતી ન
હતી. માં કરીને રોટલા ઘડી આપે ને કળશા
વાસ્તીનું કરે.

વિઠલો મેટા થયો ને હથોડો હથ એઠો. વિઠલો
નાના લાકડામાંથી મેટા લાકડા ફૂટવા લાગ્યો.
વિઠલો એને બહલે ચારચાના કુમાવા લાગ્યો. વિઠલો
અને એની મા રોટલો અને શાક ભેળા થયા.

વિઠલો સાંજે પાછો આવે ત્યારે ફૂટલા લાક-
ડાના છોડિયાં લેતો આવે. માને ચૂલો સળગાવી
દે. રોટલાનો લોટ કાઢી આપે. શાક સુવારી આપે
અને હે લે કરે.

મા રોટલા ઘડતી જય ને વાતો કરતી જય.
'બાપાવિઠલા, જેવી ભગવાને નાખી એવી
ઉપાડવી. તારા બાપ લાકડા ફાડી ફાડીને મરી
ગયા પણ આપણે એ પાંહડે ન થયા. જે છો ના,
આ ઘરમાં શું છે? ઘંટી, તાવડી ને પાણીના
માટલા સિવાય શું ભાગે છે? પણ. વિઠલા, તારા
ખાપે એક છોડિયાં સરખાની ચોરી કરેલી નહિ.
છોડિયાં લાવે ઈ એ પુછીને લાવે. વિઠલા, જેને

ખાપ, મારો પંડ તો આજ છે ને કાલ નથી પણ
તારા બાપાને રસ્તે હાલ્યો જન્મે. જેન્મે, કોઈ કામનો
ચોર થઈશું નહિ. ”

વિઠલો આ બધું સાંભળતો અને મરચું ને
રોટલો ખાતો જતો.

દોશી તો ભરી ગયાં ને વિઠલો એકલો રહ્યો.
વિઠલો જુવાનજેઘ થયો હતો. રોટલો ખાવિલો પણ
એનાં કાંઈ ખાંવડા ! અને એનું કાંઈ ખળ ! પણ
એવો બળીએ વિઠલો એવો તો શોભે કે વાત
કરો મા.

વિઠલો સવારે વહેલો ઉઠે. મોતીતળાવે નાહી
આવે. શાંકરને પાણી ચડાવે. ટાંડો રોટલો ને મરચું
આઈ લે ને પછી લોઢાં લઈ બંધ યેસરાંગું હોસો.

‘ કાં વિઠલા, વેઢા ફૂડવા આવવું છે કે ?
નકરા વેઢા છે. ’

વિઠલો કહેશે : “ વેઢા ને ઘોડાં બે કહો તે
ફાડી આપું. ”

“ વિઠલા, ત્રણું આના મળશે ત્રણું આના. ”

“ ના ભાઈ, મારે વણુ આનામાં ખાવું શું
ને બાડિને ખવરાવવું શું ?”

“ ત્યારે ચાર આના, પાંચ આના, છ આના.”
વિઠલો છ આને લાકડા ફૂડવા જય.

પસ, વિઠલો કામ પર ચહુયો એટલે ચહુયો.
અની માચે એને કાનમાં વાત કીધેલી. એના બાપને
તો એણું નજરો નજરે ભાગેલો. એના બાપ કોઈ
દિ' હરામ હાડકાં કર્યા હોય તો ને ? જેવા બાપ
સાચક એવો જ એનો હીકરો સાચક.

વિઠલો હીંહ-હીંહ કરતો જય ને છીણું
ઉપર ઘણુ પછાડતો જય, વિઠલાને હીલે પરસેવા
પરસેશ વયા જય પણ વિઠલો એઠો પારો ન
ખાય. લાકડાના વેઢા પણ એવા કે છીણુંની ધાર
ભાગે પણ એમાં લીંઠો ન પડે, પણ એ તો વિઠલો
વેઢાવો કે વેઢા તો શું, પણ એના બાપાનેય ફાડી
નાં. ખૂબ થાક લાગે ત્યારે વિઠલો પારો લે,
છાંચે એસે અને હોકલી સળગાવે. એના બાપ
નેમ વિઠલો પણ હોકલી પીતો.

વિઠલો ઘણુ પછાડે ત્યારે ધરતી ધમધમે.

છીણુંની માથે હુથોડો પડે તે જણું લોઢું તૂટી જરો. અને હાથમાં જેર એધું કે વા આવો પાછો ગયો તો ભોંમાં પા હાથ ખાડો પડી જય.

પણ વિઠલાના આવાં જેર કેટલા હિ' ચાલવાનાં ? આટલી મહેનત પાછળ ખાવાનું તો કે રોટલો ને મરચું, શાક ને છારા. ધી દૂધનું તો વિઠલાથી નામ ન લેવાય. વાર પરબે ભાગે ઈ ભાગે. મોટી વખારોની વખાર વિઠલો લાકડા ઝાડીને ભરીહે ને લાકડાવાળો. હજરો કમાય પણ વિઠલાના તો છ કે આઠ આના અલ્લાએ લખ્યા એ લખ્યા. અલ્લા પણ જખરો !

વિઠલો એવડો ને એવડો થોડોક રહે છે ? જુવાનમાંથી આધેડ અને આવિંમાંથી ધરડો થયો તોયે વિઠલો લાકડાના વેઢા ઝાડે છે. એના જેવો ખીંચે કોઈ વેઢા ઝાડીનાંનું નહિ. ધરડો! વિઠલો-હમ લેતો વિઠલો-એ પેલી છાપરી નીચે નીચે વેઢા ઝાડે. હમણાં તે થાક ખાવા એસરો. હોકલી પીરો ને વળી પાછો ખાંખોં કરતો લાકડા ઝાડવા માંડરો. હવે તો એનો હાથ પાતળો પડી ગયો

ગયો છે. નસેનસુ હંખાય છે ને હૃથોડો ઉપાડે છે, ત્યારે પેટ ને છાતી ઊંચા થઈ જાય છે ને વારે ધડીએ વિઠલાને ઉધરસ આવે છે.

સાંજ પડશે ને વિઠલો ઘેર જરો. જતાં જતાં પાંચ છોડિયાં માર્ગી લેશો. જિંહગીમાં એણે સમ ખાવા એક પણું છોડિયું નથી ચોર્યું.

હમણું વિઠલો થાક્યો પાક્યો ઘેર જરો. ખાટ-લીએ એસશે. હસ વરસના ગંગાને અને ત્રણું વર-સની ગંગાને રમાડશે અને વાળુની વાટ લેશે.

વિઠલાની વહુ બહુ સારી છે. જેવો છે એવો ગરીબ સંસાર સંતોપથી ચલાવે છે ને મળ કરે છે.

વિઠલો ખાતો ખાતો એના બાપા અને એની બાની વાતો કરે છે અને છોકરાને કહે છે કુઃ ‘ભા, એક છોડિયું સરખું યે ચોરીશ નહિ અને ‘કોઈ હિ’ પણું કામનો ચોર થઈશ નહિ.



■ ■ ■ ■ ■ ■ ■ ■ ■ ■ માળ



નહિ જીંચા, નહિ
નીચાં, એવાં એ માળ
હતાં. માળ પાતળાં તો
ન કહેવાય પણ એટલાં
બધાં જહાયે નહિ. એ
ઉમરે મોટાં હતાં પણ
દીકરા વિનાના હતાં.

એ માળ હતાં પણ કોઈ એને માળ કહે એમ નહોતું.

નાનું એવું ધર હતું. ગામડાનું એ ધર.
નીચા છાપરાનું, ભાયે નળિયાવાળું, જુના કાટવળા-
વાળું, તૂટેલાં નળિયામાંથી ખારી વિનાના ધરમાં

ચાંદરણું પડે એવું. ધરની ભીતે ગાર હતી ને ગારે
પોપડાં કાઢયાં હતાં.

ધરની ધરવખરીમાં જૂની પેટી હતી. નાનો એવો
હડક્કે [હરકેતરો] હતો. શીકું હતું. કોઈઓ હતી.
તૂટેલાં ફૂટેલાં માટેલાં હતાં. અને ભાંગેલોટૂટેલો કેટલોય
સરસામાન હતો.

ધર તેથીનું હતું કે સામાનનું હતું એ તો
ભગવાન જાળે પણ ધર તેથીનું જ હતું.

ધરના ઉંબરાની એલીકિર, ધરની અંદર
માળ બેઠાં હતાં. સોઢેણીઆની જતનું માળએ
એઢાળું એઢયું હતું. માળના વર પચ્ચીસ વરસ
પહેલાં હેવ થયાં હતાં. માળનો વેશ વિધવાનો
હતો.

મને થયું, માળ પાસે જઉં ને વાતો કરું.
મારી એવી એક ટેવ છે. આવું કોઈ મળો તો વાતો
કરવી ને અનુભવનું ભણુવું.

“ માળ, કેમ છો ? ”

“ હીક છે ને ભા. ”

“ માણ, જમ્યા કે હજ વાર છે ?”

“ આજે રામનોમ છે. આજે અપવાસ છે. હમણાં લોટ માગી આવી. આ તાંખડીમાં આટલો આવ્યો. ”

માણની તાંખડીનો લોટ મેં જોયો. મારો ભાઈ-ખંધ જમનો નાનપણુમાં લોટ માગતો તે મને યાદ આવ્યું. નશુ શુકલની તાંખડી નજરે તરી.

“ માણ, આટલો બધી લોટ રોજ મળે છે ?”

“ નારેભા, હું તો એ ચાર હિ' યે આંગો મારું છું. મારા એક પંડને ખાવું એટલે કેટલોક લોટ જોવે ! અને મને તો ખરક પ્રાલિંગને ત્યાંથી રોજ રોટલોને શાક મળો એટલેં આ લોટ તો કોકવાર કામ આવે. એનું વળી શાક પાંહડું એવું લેવાય. અમે અતીત ખાવા છીએ. આ મંહિરમાં મારો ભાઈ પૂનરી છે. હમણાં અમે નોખાં રહીએ છીએ. ”

માણ નિરાંતે વાતો કરતાં હતાં. વર્ષોથી ગોઠ-વાઈ ગયેલી જિંદગીની વાત કરતાં તેના મેં ઉપર એક્યે જલની સારી માઠી અસર નો'તી થતી. ધણી

મરી જય, દીકરો મરી જય, ભાઈથી નોખા
રહેવું પડે, કોણીઓ જેટલી ઓારડીમાં પડ્યા
રહેવું પડે, એ બધું તૃશીને મારે જાગું કાયદા
પ્રમાણે લાગતું હતું.

“ માણ, આ રોટલો શેનો ? ”

“ ઈજ હું કહેતી તી ને ખરકને ત્યાંથી આવ્યો
છે. ”

“ પણ આજ તો રામનવમી છે. ”

“ હા, એટલે તો વર્તીનું શાક ભાઈને ત્યાં
મોકલ્યું ને આ રોટલા કૂતરાને નાખીશ. ”

મને થયું કે આ રોટલો પવિત્ર છે. હ્યાવર્મ સમજ
ખરકે ખાઈને આપ્યો છે. કૂતરાને મળો કે હું ખાઉં
એમાં વાંદ્યા શું છે ?

“ માણ, મને ખાવા આપશો ? ”

“ તમે શું કામ ખાયો બા ? ”

“ મને ભૂખ લાગી છે. મારે તો રોટલો ખાવો
છે. હું તમારો દીકરો છું, એમ ગળ્યીને રોટલો
અવરાવો. ”

માળ અવાકુ રહ્યાં મેં રોટલા હાથમાં લીધો.
માળ પાસેથી એક ચારી ઢારીને એમાં મેં
મુક્યો.

માળ કહે, “ હોયા, શાક મંગાડું, એલયે ઘેર
આપી હીધું છે તે. ”

મેં તો લૂણા જ રોટલા આવાનું શરૂ કર્યું.

ત્યાં તો બીજુ એનો ખાયામાં લગ્યા. ત્યાં તો
શાક આવ્યું, ત્યાં તો છાશ આવ્યી, ત્યાં ખાંડિલાં
મરચું ને મીઠું આવ્યાં, ત્યાં તો નાળું જરાક
માખણું હતું તે આપ્યું.

“ માળ, માખણ કયાંદી ? ”

“ એ તો રોટલા હારે આવેલું છે. ”

માળ તો એઠાં જ હતાં. અમને ખાતાં જેઈને
તાજુખ થતાં હતાં. ભાઈને વેરવી રોટલા ઉપર રોટલાં
મંગાવતાં હતાં અને અમને અવરાવતાં હતાં. ગાડાના
પૈડાં જેવો રોટલો, જડી રેડ જેવી છાશ, ખાંડિલું મીઠું
ને મરચું અને તીખી આગ જેવી વડીનું શાક ! આધું
ખીધું ને હો... છચા કર્યું.

“ માળ આજે તો બહુ લહેર આવી. ”

“ સારું થયું ને ? ”

“ માળ, ફરાળમાં શું ખાશો ? ”

“ આ ગામમાંથી શક્રિયાં આવશે તો ઈ, નકર
ખેટાં લઈ આવીશ ને બાક્તીને ખાઈશ. ”

“ માળ, તમને બહુ ગડખડ થઈ ને અમે તમને
હુરાન કર્યો. ”

“ ના, મા, ગડખડ શેની ! એમાં હુરાન શેના ? ”

“ માળ, ત્યારે હવે રજી કેશું. ”

“ ભલે ભા. ”

માળ પાસેથી અમે વિહાય લીધી ને ચાલતાં
થયાં. માળ અમારી સામે ટગર ટગર જેતાં કુચાંય
સુધી ઊભાં હશે તે કોણું જાહેર !



કાનો રખારી



કાનો સીમમાં રહેતો
અને ઢોર ચારતો. કાનો ઢોર
ભેગો ઢોર થઈને રહેતો.
કાનો ઢોર પાછળ ફરે, દ્વધ
પીએ, ઢોરની વર્ષયે સુએ
અને ઢોરની ભાળ રાએ.

એવાં અને ઢોર વા'લાં,
એવાજ કાનો ઢોરને વા'લો.

કાનો ઢોરથી આધ્યાયે ન જય ને પાછોય ન
જય. કાનો ઢોરની આગળ હાલે ને કાનો ઢોરની
પાછળ હાલે, અને કોઈ કોઈ દિ' કાનો ઢોરની વર્ષયો-
વર્ષય પણ હાલે.

ઢોર પણ એવાં કે કાનાની નજર વેગે રહે.

જરાક આધાં જય ને પાછું વળીને ભેયે. જરાક વાંસે રહી જય તો હડી કાઢીને કાના ભેળાં થાય.

સવાર થાય, ઠોર ચરે ને કાનો પાવો વગાડે. ઠોર ચરતાં જય અને વાંસળી સાંભળતાં જય. વાંસળી જરાક બંધ થાય કે ઠોર ઊંચી ડોક કરીને ભૂઘે. કાનો કૃયાં ગયો? વાંસળી કેમ નથી વાગતી?

ખ્યેલ થાય ને ઠોર વડ હુંઠ આવે. તાજી મજની શીળા નીચે ઠોર બેસે ને બેઠાં બેઠાં વાગોળો. નાનાં વાછડાં આમતેમ કુહેને ગળાની ટોકરી ટન્ન ટન્ન થાય. નાનાં પાડરું એમતેમ ઠંકે ને કુણું કુણું રણુકે. કાનો વડને ચડાડાએ પડાએ થાય ને અને બેચાર મીઠાં ઝોલાં ખાય.


લ્યાં તો સાંજ પડવા આવે અને કાનો હાકેટા કરે. ધણું આખું ઊભું થાય ને ગામ ભણી હાલી નીકળે. મોઢા આગળ ધણું અને વાંસે કાનો. કાનાને ઊંચી એડીવાળા જેડા, બોરિયાવાળો લક્ષ્ણશીઓ. ચોરણું ને ચોરણું કેડીયું અને જમણું ખલે ડંગ. ઠોરનો ધણી, સીમના સિંહ જેવો રખારી, સૂરજ આથમે ધેર આવીને ખાટલી ટાળીને હુડો બેસે. પુની રખારણું ગાયો લેંસોને હોલી ને દૂધનાં બોધડાં ધરમાં મૂકે.

રાત ૫૫ ને વાળુ વેળા થાય. કાનો રખારી ને પુની રખારણુ, લાખો, એનો હીકરો ને લાખી, લાખાની વહુ, અને નંદુ ભીખસો ને નથુડો રળિયાત, આખું કુદુંખ હૃદૈ વાળુ કરે. ગાડાના પૈડાં જેવો રોટલો ને હૃદ્વ ને સાથે ગાજરનું અથાગું.

કાનો રખારી ઢોરઢાંખરે ભરેલો હતો. શરીરે સરાક્ત હતો. એ માણસમાં પૂછતો. પુની રખારણુ છોકરેછૈયે નકિલી હતી. શરીરે સબ્લપાવાળી હતી અને પાંચ આયરીમાં ગણ્ણાતી. છૈયાંછોકરાં આંગણામાં રમતાં, ઓરડીનાં પાંદડાંની છાશ કરતાં, નળિયાની ગાડી કરતા, બોલકી બોલકીની રમત કરતાં અને મોટાં થતાં એમ સીમે જતાં.

રખારી સુખી હતો. રખારણુ સુખી હતી. રખારીનાં છોકરાં સુખી હતાં.

સૌ સંખીને રહેતાં, ઢોર પાળતાં ને ઢોર ચરાવતાં. રોટલાને હૃદ, રોટલા ને માખણુ, રોટલાને છાશ અને ખીચડી ને ધી આતાં ને લહેર કરતાં. કોકવાર કળથીનું, તો કોઈવાર મગનું, તો કોઈવાર અહનું શાક આતાં ને મજ કરતા.



નથ પીંડારો

“કું, નાયુકાડા.
હવે હી પીજવા કયા-
રે આવશો? પાંચ
ગાહલાં ભરવાં છે તે
હવે આવોને! ”

નથુ કહે: ‘ભાઈ, કાલ આવું. કાલ સવારે જરૂર !’
 પણ . નથુની કાલ પડે નહિ અને નથુ ગાહદા
 ભરે નહિ.

નથુ ગામ સમ એક જ પીંખરો. એક પીંખરો
તો પીંખરો પણ કામનો ઉસ્તાદ પીંખરો. ઉસ્તાદ તો
ખરો પણ હાથનો પૂરેપૂરો ચોકાઓ. ઝનું એક પુમડુંયે
ન ખગડે તો !

નથુકાકાને કામનો પાર નહિ ને હિ'નો દુકાળ.
પણ નથુકાકા જ્ઞાનના મીઠા અને કામે ઉતાવળા.
'કાલ્ય આવીશ, કાલ્ય આવીશ' એમ કહેતા જય
અને એમ કરતાં એક સવારે આવીને ઊભા પણ રહે.

એક હિ' નથુકાકા આવ્યા ને આંગણામાં આવી.
ઊભા રહ્યા. 'એ આવ્યો છું બેન, ગાઠલાં, ગોઠડાં,
એશીકાં ને ભરાવવું હોય ઈભરાવી લ્યો. ધરેય નથી
જવું ને બારેય નથી જવું. રમજુડાની મા ગઈ છે
ખદારગામ. એ ત્રાણ હિ' હાથોહાથ છે. આ અહીં જ
ખપોર કરી લઈશા ને પાછો કામે વળ્ણિશ.'

બાપા કહેશે: 'એલા નથુ, રહ્યો તો ખરો.
આવું કરે તો અમને ખડુ ગમે.'

બાપા કહેશે: 'એ ચાલો કયાં ગયા? હવે જ/ પી-
જવવું હોય, ભરાવવું હોય, ઈભરાવો. એલીએરડી
ખાલી કરો ને ઈ નથુભાઈ ને સોંપી ધો.'

નથુ એરડીમાં તાંત ઉતારે. માથે બંધણું
મૂકે ને જુનાં ગાઠલાં ઉઘેડવા માંડે.

નથુ વચ્ચે વચ્ચે બોલતો જય. આના કરતાં
તો નવું હું નાખો તો સોધું પડે. એંણું હું ના ભાવ
સાવ સોધાં છે. આ તો સોના કરતાં ઘડામણુ મોદું
થરો. હું બેટલું તો મારું પીંજમણુ થરો.

આ કહેશો: ‘હવે એંણું તો થયું તે થયું. તમ
તમારે વરસે વરસ કરો છો એમ કરોને !’

નથુકાકા જુના હુનો મોંગા બંધા ઢગલો કરે. પછી
કાથીના ખાટલા ઉપર નાંખ અને પછી એને વાંસની
લાંઘી સેટીઓ વડે સણોએ. હુંને એવું ગસિવાએ એવું
સણોએ કે હુમાંથી બર્બા કીટી ખરી જય અને હું હલકું
હલકું થાય.

કાકા એમને કહેશો: ‘તમે એરહીમાંથી વચ્ચા
જાઓ, નકર કીટી ગળામાં જશો અને ગળું રહી
જશો.’ પોતે તો નાક અનું મોઢા આગળ એકીનું
ખાંધે અને પછી હું ને ધમધમાવે.

પછી નથુકાકા પીંજમણુ લે. હેં હ્રદ, હેં હ્રદ, હેં
હ્રદ, હેં હ્રદ થવા માંડે. નથુકાકા એક હાથે પીંજમણુ
પડ્યે, બીજે હાથે ધોકો હલાવે નેતાંત ઉપર હું ચઢાવે.

પીંજણું ટ્રેં ટર્ડ થવા માંડે ને ઝુતાંત ઉપર ચડી ચડી ને ચોખણું થવા માંડે.

નથુકાકાનો કંઈ હાથ! એવો તો મજબૂત અને એની તે કંઈ ફાળ! વડીકમાં તો કેટલું બધું ઝુપીલ નાંખે. પીંજ પીંજને ઝુતો મોટો ફગલો કરે. ઝુપીલ મજનું બારના જેવું ચક્કી જય. નથુકાકા કહે: ‘એ જુઓ હવે આ ઝુ? કેવું હતું ને કેવું થયું? છે કંઈ કેવાવારો? ઘોળું દૂધ જેવું થયું છેના?’

લાં તો બપોર થાય ને નથુકાકા તાંત હેઠી મૂકે. નથુકાકા કેમ જાણું બરનું માણસ હોય તેમ ખાને સાહ પારીને કહે: ‘એ બેન, લાવને હવે ખાનાનું. બપોર તો કયારની પડી ગઈ.

નથુકાકા હાથ, મોટું, કપાળ, હાઢી ધૂઅ. હાઢીમાં જરા જરા ઝુભરાયું હોય એ તો એમ ને એમ રહે. કાકા કંઈ કાચમાં જેવા નવરા ન હોય કે હાઢીએ ભરાએલ ઝના ખુંભણું કાઠવા એસે. નથુકાકા કોણી સુધી હાથ ધૂઅ, ગોઠણું સુધી પગ ધોઈ ને પછી હાશ કરી પલાંઠીવાળી જમવા એસે.

એમ તો બા સારાં હતાં. ધરમાં જે રાંધું હોય તે
ખંડું નથુકાકાના ભાગુમાં પીરસે. કરો લેહભાવ ન રાખે.

નથુકાકા નિરાંતે ખાય. પછી જરા આદે
પણે થાય ને વળી પાછા કામે લાગે. નથુકાકાનું
ઈ ભારે. નથુકાકા નકામી એક પળ પણ ન ગાળે.
કામ સાચે કામ. આટી બડાઈ એ નહિ ને અલક-
મલકના ગપપાંચે નહિ.

નથુકાકા ખોળીયામાં ઝુ ભરવા માંડે. ગાહલાં
ભરે, ગોહડાં ભરે, આશીકાં ભરે. ખંડું ઝરપટ ભરી
નાંખે. કાકા ભરવામાં હુશિયાર. એકલે પંડે કામ
કરે પણ મોળા નહિ. ઝુ ભરતા જય, સોટીથી સરામું
કરતા જય અને ગાહલું મજનું ભરતા જષ.

ગાહલું ભરાઈ જય, ગોહડું ભરાઈ જય, પછી
નથુકાકા હારી કાઢે ને ફીટિયા લે. ફંટીએ ફંટીએ
ફૂદડી મૂકતા જય ને દાખીને ફંટાએ લેતા જય.
એમ કરતાં કેટલું ખંડું ભરી નાખે.

એમ કરતા સાંજ પડે નથુકાકા ખલે ઘશિયું
નાંખે, માથે ફેંટિયું મૂકે ને ધર ભણી હાલે.

હાલતાં હાલતાં કહેતા જ્યઃ ‘એ કાલે ય આવીશ.
કામ ભેળું કામ, વળી વરસ હિ’ની વાર. જેટલું કાદવું
હોય તેટલું કાઢી રાખજો.’

નથુકાકા હાથમાં તાંત લઈ ધેર જ્ય ને અમે
નવા ગાહલામાં આપોટીએ.



■ ■ ■ ■ ■ ■ ■ रत्नो भांड



અમૃતે નિશાળમાં ભણુતા
હતા. મોટા મહેતાજ લાંખી સેઠી
લઈ ભણુવતા હતા. નિશાળમાં
કલખલ કલખલ થતું હતું અને
મહેતાજએ પરાડતા હતા.

એકદમ બેચાર છોકરા હોડતા.
આખ્યા અને મોટા મહેતાજને
કહે મારતર સા'ખ મારતર
સા'ખ આપણા ડિપોટી સા'ખ
આવે છે. એ પણે દરવાજ આગળ હેખાય.

મોટા મહેતાજ હેખતાઈ ગયા. એકએક ડિપો-
ટીસાહેખ કયાંથી? અતો હંકલા ફંકલા થઈ ગયા.

ટેબલ ઉપરથી ઝેંડો માથે મૂક્યો પણ સવળાને બદલે અવણો મૂકાયો. ગભરાટમાં ને ગભરાટમાં મહેતાજની પાછડી કાછડીનો છેંડો છૂટી ગયો. મહેતાજ ડિપોટીને લેવા માટે સામે હોડયા. નિશાળ આખી ચૂપચાપ થઈ ગઈ. બધા શિક્ષકો ટાઢાટમ થઈ ગયા.

લાં તો ડિપોટી નજીક આવ્યા. બરાબર ડિપોટીજ. એમાં જરાકે કુર નહિ. નાકે ચરમાં, ખલે એસ, હાથમાં લાકડી ને માથે ગુજરાતી પાધડી. અસલ ડિપોટીની જ ચાલ.

મહેતાજ અને ડિપોટી નિશાળના ખારણા આગળ લેટાલેટ થઈ ગયા. મહેતાજએ સલામ કરી આવકાર આપ્યો: ‘પદ્મારો શા’બ. એચીંતા ક્યાંથી?’ લાં તો ડિપોટીના મોઢામાંથી એ લાંબા દાંત હેખાયા ને મહેતાજ સમજ ગયા કે આતો પેલો રતનો ભાંડ. લાં તો રતનો ભાંડ હસીને બોલ્યો: ‘વાહ મહેતાજ શા’બ, ભણેલ ગણેલ તમેય છેતરાણા? લયો, હવે રાજ કરો.’ મહેતાજએ ચાર છ આના આપી રતના ભાંડને રાજ કર્યો.

‘એક દિ’ મારી કાકીવાત કરવા એઠાં કે આજ તો

ભારે ગમ્મત થઈ. અમે નહીંએ એહાં ઉટકી પાણી ભરતા'તાં ત્યાં એક બીજી આવી ને એ પણ એડું ઉટકવા લાગ્યો. અસલ બીજી જેવી જ બીજી. પગમાં ચોરાણી, હીલે અંગરાણો ને નાકે વાળી. અમને થયું આ ગામમાં તો મુસલમાન નથી ને આ બીજી કુયાંથી? ત્યાં તો બીજીએ જરૂર લઈને અમારા ગાંઠલા વીરદામાં છાલિયું એહયું ને પાણી ભર્યું. અમે તો જોઈ જ રહ્યા. અમે કંઈક કહેવા જઈએ ત્યાં તો બીજી લાંબા હાથ કરીને બાજવા ને પોતાના ધરાનું પાણી અમારા ધરા ઉપર નાખવા લાગ્યો. અમે એક ભાઈને સાહ કર્યો ત્યાં તો મોઢામાંથી એ હાંત કાઢ્યા ને ખડખડ હસવા લાગ્યો. અમે તુરત એને એણાખી ગયાં. અમે કીધું: ‘એય, આ તો રતનો લાંડ. રોયાને બીજીને વેષ પણ અસલ આવડે છે.’

પાસે એઠલા બાપુએ કહ્યું: ‘અરે, રતનો તો અસલ ભાંડ છે. એકવાર એણું ભારે કરેલી. દશરાનો હિવસ હતો અને દરખારમાં કચેરી ભરાએલી. ગવૈયો ગાતો હતો. વાડુર ઢોળવાવાળા દરખારને વાડુર ઢોળતા

હતા. છરીદાર છરી પોકારતો હતો. ખાપુ બેઠા બેઠા ખધું આનંદ્યી જેતા હતા. એટલામાં સળવળાઈ થયો અને કુચેરીને બીજે છરેથી લોકો ઉઠવા લાગ્યા ને સલામ ભરવા લાગ્યા. ચારેકોર કાનમાં કાનમાં વાત થવા લાગ્યી. ‘ગોરો આવ્યો છે.’ ‘ગોરો આવ્યો છે.’ ‘પ્રાંતનો શા’ખ હશે.’ ‘મોટો શા’ખ હશે.’ હિવાન સુધીના ખધા માણુસો એકદમ ઉભા થઈ ગયા.

સાહેખ તો ટક્કારને ટક્કાર ચાલ્યો આવતો હતો. હાથમાં મોટી લાડુડી, મોામાં ચિર્દિ, ખગલમાં ટોપો અને રોકુ તો કયાંઈ માય નહિ. અસલ ગોરો જે જેઈ દ્યો. ગાલ તો લાલ લાલ ટમેટા જેવા.

ખધા ઉભા થયા પણ જ્યાં ખાપુ ઉભા થવા જ્યાં તો રતનાએ મોઢામાંના એ મોટા દાંત ખહાર કાઢ્યા. રતનો એકદમ સલામ ભરી બોલી ઉઠ્યો: ‘ખમા ખાપુ, ખમા અનનહાતા. ધાણું જીવો અમરસંગળ ખાપુ.’ આખી કુચેરી રતનાની સામે જેઈ રહી. રતના ભાંડ હિવાનશા’ખ સુધીના સૌને ઉભા કર્યા. ખરો, રતનો ભાંડ ખરો.


આવું આવું તો રતનો કેટલુંયે કરે. મનમાં આવે એવો વેષ રતનો કાઢે. અને ખધાયને ભૂલમાં નાએ.

પછી છેલ્લી ઘડીએ ખાટા હાંત હેખાડે ને ખડખડ હસે
એટલે સૌ જાળું કે આતો ભાંડ !

કાંઈક વાર પરબ્ય હોય, મારો એવો તહેવાર
હોય, ત્યારે રતનો નવો વેપ કાઢી લાવે ને લોકોને
ખુશી કરે.

ગામના છોકરાં તો રતનાની પાછળ પાછળ
કૃથા જ કરે. એકવાર ખબર પડી કે આ રતનો છે
એટલે તો છોકરાં આધા ખસે જ નહિ.

રતનો ભાંડ ખરો વેષવારી. હજ એના જેવો
ખીંચે કોઈ જ્યો નથી. એનાં અમે કંટલાયે વેપ
જેયેલા. કુંભારનો, નગરશોઠનો, વાળંદનો, પ્રાણણુનો,
પટેલનો, પખાલીનો, ખધાયના વેપ અમે જેએલા.
રતનો ભાંડ જિંદગી સુધી સાંભરશે.



બાળકોનું

સચિત્ર

માસિક

લવાજમ
દેશમાં
૩-૦-૦



લવાજમ
પરદેશમાં
૪-૮-૦

તંત્રીઓ।

સેમાલાઈ ભાવસાર : દિનેશ ઠકેર

○

- એકજ વર્ષ વીતતાં ને બાળમાસિકોની મોખરે આવી ઉલ્લંઘું છે.
- એમાં હરેક અંકે બાળકોને મનગમતી વાતો, ગીતો, પ્રવાસવર્ણનો, વિજ્ઞાનકથાએ વગેરે આપવામાં આવે છે.
- ધડિયાળના ટકોરાની જેમ હરેક માસની રૂલી તારિખે ને બાળકોના હાથમાં આવી જાય છે.
- તમે એના આહક નથી? તો આજેજ લખો.

નવચૈતન સાહિત્ય મંદિર, ૨૪૫૬; ભદ્ર : અમદાવાદ.

લોઈકાન પ્રદર્શન : અમદાવાદ.

